

April 11, 2024

BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai 400 001

National Stock Exchange of India Limited
Exchange Plaza, 5th floor
Plot No. C/1, G Block
Bandra-Kurla Complex
Bandra (East), Mumbai 400 051

Dear Sir/Madam,

Sub: Notice published in the newspapers for transfer of equity shares to IEPF

Please note that Notice to Shareholders for transfer of equity shares of the Bank to Investor Education and Protection Fund (IEPF) has been published today i.e. on April 11, 2024 in Financial Express (all editions), Indian Express (Baroda Edition) and Vadodara Samachar (Baroda Edition). We enclose herewith copies of the advertisements published in Financial Express (Mumbai edition) and Vadodara Samachar.

Please take the same on record.

Yours sincerely,

For ICICI Bank Limited

Rinku Maniar
Head - Stakeholders Management & Governance

Encl: as above



ICICI BANK LIMITED

CIN: L65190G11994PLC021012

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara 390 007, Gujarat, Phone: 0265-6722286

Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Mumbai 400 051, Maharashtra, Phone: 022-4008 8900

Website: www.icicibank.com, Email: companysecretary@icicibank.com

NOTICE TO SHAREHOLDERS

[For transfer of equity shares of the Bank to Investor Education and Protection Fund (IEPF)]

This Notice is published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") notified by the Ministry of Corporate Affairs effective September 7, 2016 and subsequent amendment thereto.

Pursuant to applicable provisions of the Companies Act, 2013 read with the Rules and amendment thereof, the shares in respect of which dividend has not been paid or claimed for seven consecutive years are required to be transferred by ICICI Bank Limited ("Bank") to IEPF.

In compliance with the requirements set out in the Rules, the Bank has communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to the IEPF under the said Rules for taking appropriate action(s) on or before July 15, 2024 failing which the shares will be transferred to IEPF in adherence to the procedures prescribed under the Rules. The Bank has uploaded the details of such shareholders on its website. Shareholders can access the weblink: <https://www.icicibank.com/about-us/invest-relations>, click on "More" and then click on "Shares Liable For Transfer to IEPF" to verify the details.

The concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to the IEPF, may note that the Bank would be issuing new share certificate(s) for the purpose of transfer of shares to the IEPF as per the Rules. The concerned shareholders holding shares in dematerialised form may note that the Bank shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the Demat account of the IEPF.

The shareholders may further note that the details uploaded by the Bank on its website shall be regarded and be deemed as adequate notice for the purpose of transfer of shares to the IEPF pursuant to the Rules.

In case the Bank does not receive any communication from the concerned shareholders by July 15, 2024, the Bank shall with a view to complying with the requirements of the Rules, transfer the shares to the IEPF on or before such date as may be prescribed as per the procedure set out in the Rules.

Shareholders may note that both the unclaimed dividend and corresponding shares transferred to the IEPF including all benefits accruing on such shares, if any, can be claimed from the IEPF Authority after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, shareholders are requested to contact the Bank's Registrar and Share Transfer Agents, KFin Technologies Limited, Unit: ICICI Bank Limited, Selenium Building, Tower-B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serlingampally, Hyderabad 500 032, Rangareddy, Telangana, Toll Free No.: 18003094001, Email: einward.ris@kfinotech.com.

For ICICI Bank Limited
Sd/-
Prachiti Lalingkar
Company Secretary

Place : Mumbai

Date : April 10, 2024

